

ત્વરિત જાહેરાત માટે

## સુસન ફેનેલ સ્પોર્ટ્સપ્લેક્સમાં ઊર્જાનો બચાવ થાય એવા અપગ્રેડ્સ માટે સિટીને કેનેડાની સરકાર તરફથી \$15.7 મિલિયનનું નીધિયન પ્રાપ્ત થયું

બ્રમ્પટન, ઓન્ટારિયો (19 જુલાઈ 2022 – આજે બ્રમ્પટન સાઉથના સાંસદ સોનિયા સિધુએ માનનીય ડોમિનિક લબ્લાંક, આંતર સરકારી બાબતો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સમુદાયોના પ્રધાન, અને મેયર પેટ્રિક બ્રાઉન વતી બ્રમ્પટનમાં સ્થિત સુસન ફેનેલ સ્પોર્ટ્સપ્લેક્સમાં ડીપ એનર્જી રેટ્રોફિટ્સ માટે \$15.7 મિલિયનના નીધિયનની જાહેરાત કરી હતી.

ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવા અને સ્પોર્ટ્સપ્લેક્સની ઊર્જા કાર્યક્ષમતામાં વધારો કરવા માટે આ ભંડોળ અનેક અપગ્રેડ્સને ટેકો આપશે. આ કામમાં સવલતના રેફ્રિજરેશન પ્લાન્ટ્સ, HVAC સિસ્ટમો, ભવનની ઓટોમેશન સિસ્ટમ અને લાઈટિંગ વ્યવસ્થાને અદ્યતન કરવું સામેલ છે. વિજળીના ખર્ચને ડામવા માટે બેટરી એનર્જી સ્ટોરેજ ઊભું કરવું અને જમીનને હિટ ટ્રાન્સફરના માધ્યમ તરીકે વાપરીને સવલતને ગરમ રાખવા કે ઠંડી કરતી જથોથર્મલ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ રેટ્રોફિટ્સ કુદરતી ગેસના ઉપભોગને ઘટાડશે અને નોંધપાત્ર રીતે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનો ઘટાડશે જેથી આ સવલતને નેટ ઝીરો સવલત તરીકે પરિવર્તિત કરી શકાય.

સુસન ફેનેલ સ્પોર્ટ્સપ્લેક્સનો એક હિસ્સો જાહેર જનતા માટે હાલમાં બંધ રાખવામાં આવ્યો છે કારણકે આ જીર્ણ થયેલ રિક્રિએશન સેંટરના કાયાકલ્પ માટે બાંધકામ થઈ રહ્યું છે. સુસન ફેનેલ સ્પોર્ટ્સપ્લેક્સ ખાતેનું બાંધકામ [પાર્ક્સ એન્ડ રિક્રિએશન માસ્ટર પ્લાન \(Parks and Recreation Master Plan\)](#) ના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે અને તે સમુદાયોની સેવા વધુ સારી રીતે થઈ શકે તે માટેના સિટી ઓફ બ્રમ્પટનની રિક્રિએશન સેંટરનો કાયાકલ્પ કરવાની યોજનાનો ભાગ છે.

સિટીએ સુસન ફેનેલ સ્પોર્ટ્સપ્લેક્સને ઝીરો કાર્બન રેટ્રોફિટ માટે એટલા માટે પસંદ કર્યું કારણકે આ રિક્રિએશન સેંટર દર વર્ષે આશરે 1,135 ટન કાર્બન ડાયોક્સાઈડ છોડે છે જે લગભગ 240 કાર દ્વારા પેદા થતા GHG ઉત્સર્જનો બરાબર છે.

બ્રમ્પટનના કમ્યુનિટી સેંટરો માટેના રિન્યુઅલ આયોજનો વિશે વધુ જાણવા માટે [અહીં](#) જુઓ. કેનેડા સરકારના ગ્રીન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમ્યુનિટી બિલ્ડિંગ્સ પ્રોગ્રામ વિશે [અહીંથી](#) વધુ જાણકારી મળશે.

### સુવાક્યો

"કેનેડા સરકારના અમારા સહયોગીઓનો તેમના સુસન ફેનેલ સ્પોર્ટ્સપ્લેક્સમાં કરેલ ઊર્જા કાર્યક્ષમ અપગ્રેડ્સ માટેના રોકાણ માટે ખૂબ ખૂબ આભાર. બ્રમ્પટન હરિયાળું શહેર છે અને અમારા કાર્બન પદચિહ્ન ઘટાડવા અને ટકાઉપણામાં નેતૃત્વ લેવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. આ રોકાણથી અમને અમારા બળતાણના વપરાશને ઘટાડવામાં અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનો ઓછા કરવામાં મદદ મળશે અને અમારા રહેવાસીઓ માટે આધુનિક અને ઊર્જા કાર્યક્ષમ સવલત ઊભી કરી શકાશે જ્યાં તેઓ અમારા ઉચ્ચ કોટિના રિક્રિએશનલ પ્રોગ્રામો માણી શકશે અને સ્વસ્થ તથા સક્રિય જીવનશૈલી જાળવી શકશે.

- પેટ્રિક બ્રાઉન, મેયર, સિટી ઓફ બ્રમ્પટન

“સિટી ઓફ બ્રમ્પટન આપણા રહેવાસીઓ માટે ફેરફાર કરી શકાય એવી, બહુવિધ વપરાશ, એક કરતા વધુ પેઢીઓ માટેની અને વિવિધ ઋતુઓ માટેની સુવિધાઓ પ્રદાન કરવા માટે ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણા જીર્ણ થતા જતા રિક્લિએશન કેન્દ્રોને પુનર્જીવિત કરવા માટે સમર્પિત છે જેથી તેઓ સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી જાળવી શકે. આ સુવિધા ખાતે અમે જ્યારે ઈંદાણના ઉપભોગને અને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનોને ઘટાડવા માટે કાર્ય કરી રહ્યા છીએ ત્યારે કેનેડા સરકારના સુસન ફેનેલ સ્પોર્ટ્સપ્લેક્સમાં રોકાણ બદલ તેમનો આભાર માનીએ છીએ.

- પૉલ વિસેન્ટ, રીજનલ કાઉન્સિલર, વૉર્ડ 1 અને 5; પબ્લિક વર્ક્સ એન્ડ એન્જિનિયરિંગ, સિટી ઓફ બ્રમ્પટનના પ્રમુખ

“એક હરિયાળા, સ્વાસ્થ્યપ્રદ અને સલામત શહેર તરીકે અમે અમારા રહેવાસીઓને આધુનિક મનોરંજનના અવસરો પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને ટકાઉપણાને સર્વોપરી રાખીને અમારી સુવિધાઓનો કયાકલ્પ કરી રહ્યા છીએ. કેનેડા સરકારના અમારા સહયોગીઓનો તેમના સુસન ફેનેલ સ્પોર્ટ્સપ્લેક્સના ઊર્જા કાર્યક્ષમ અપગ્રેડ્સ માટેના રોકાણ માટેના ભંડોળ માટે આભાર. અમે બ્રમ્પટનમાં નિવેશ લાવતા રહેવા માટે અમારા સહયોગીઓ સાથે કાર્ય કરતા રહીશું.”

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રમ્પટન

સુસન ફેનેલ સ્પોર્ટ્સપ્લેક્સમાં થનાર અપગ્રેડ્સ બ્રમ્પટનવાસીઓને એક એવી આધુનિક અને ઊર્જા કાર્યક્ષમ સુવિધાનો લાભ આપશે જ્યાં તેઓ ભેગા મળી શકશે, પ્રોગ્રામિંગનો લાભ લઈ શકશે અને સક્રિય રહી શકશે. આપણી સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓમાં નિવેશ કરવાનું ચાલુ રાખશે જે આપણા સમુદાયોને મજબૂત બનાવે અને આપણા અર્થતંત્રનો વિકાસ કરે.”

- માનનીય ડોમિનિક લબ્લાંક, આંતર સરકારી બાબતો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સમુદાયોના પ્રધાન, અને મેયર પેટ્રિક બ્રાઉન વતી સોનિયા સિધુ, બ્રમ્પટન દક્ષિણના સાંસદ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca)

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):



## Media Release

सीटी ओड् ब्रॅम्पटन मल्टिकल्चरल मिडिया

[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)